

Super Visa/ Visitor to Canada Insurance

Best Mortgage Rates
1st and 2nd Mortgages
Life and Critical Illness Insurance
RRSP/RESP/INVESTMENTS

Ph.: 416-839-9645

Mukund Sheth
Financial Advisor
www.pyramidfinancial.ca
Serving at 2 locations
GTA East / GTA West ON LIC # 10530
Investment | Insurance | Mortgages

परदेशां देशी महक अटले

स्वदेश

केनेडाथी प्रसिद्ध थतुं सर्वोत्तम गुजराती साप्ताहिक SWADESH

FOR BUYING, SELLING & LEASING
Investment In Real Estate Can Make Your Future Better...

FOR SELLERS
Free Home Staging Consultation
Professional Photography & Virtual Tour
Attractive Advertising
Social Media Marketing
Customized Feature Sheet
Weekly Open House
Assist in Mortgage & Legal Services

FOR BUYERS
Team of Strong Mortgage Brokers
Team of Lawyers
Professional Home Inspectors
Step by Step Guidance Through out Buying Process

AMIT SHAH
Sales Representative
Dir: 647-995-5640
amitshah@gmail.com

KOMAL SHAH
Sales Representative
Dir: 647-624-5640
komalshah@gmail.com

Homekey236@gmail.com
Web: www.amitshah.ca

FRIDAY, 17 JUNE, 2022 Vol. 19, No. 24 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news



अग्निपथनो विरोध
बिहार सणथुं

7 राज्यमां हिंसक प्रदर्शन

हरियाणा पलवलमां प्रदर्शनकारीओअे रस्ताओ जाम करी दीधा, आरा स्टेशन पर पथरमारो, टियरगोसना सेल छोडया

नवी दिल्ली
गुरुवारे केन्द्र सरकारनी अग्निपथ योजनाओ बिहार, हरियाणा अने उत्तराखंड सहित अनेक राज्योमां भारे विरोध थयो डतो. बिहारमां प्रदर्शनकारीओअे ट्रेनमां आग लगावी दीधी छे, आरा स्टेशन पर पथरमारो कर्यो डतो. लोकोंने काभूमां लेवा माटे पोलीसे टियरगोसना सेल छोडया डता. हरियाणा पलवलमां प्रदर्शनकारीओअे रस्ताओ जाम करी दीधा डता. उत्तराखंडमां पण विद्यार्थीओ रस्ता पर उतरिने प्रदर्शन करी रखा डता. आ तरफ राजस्थानना अजमेरमां युवानोअे भारे विरोध प्रदर्शन करवानी साथे पथरमारो कर्यानी विगतो मणी रडी छे. युवानो आ योजनाने पाछी भेंचवा माटेनी मांग करी रखा छे. नॉधनीय छे के केन्द्र सरकारे बुधवारे अग्निपथ योजना लोन्य करी छे. महत्वनुं छे के केन्द्र सरकारनी जडेरत पछी उत्तरप्रदेश, मध्यप्रदेश अने हरियाणा जेवा भाजप शासित राज्योअे अग्निवीरोने राज्य सरकारनी नोकरीमां प्राथमिकता आपवानी जडेरत करी छे. युपीमां पोलीसमां सेनामांथी मुक्त थयेला अग्निवीरोने प्राथमिकता आपवानी वात कडेवामां आवी छे. आ तरफ मध्यप्रदेश अने उत्तराखंड सरकारे पण अग्निवीरो माटे जडेरत करी छे. हरियाणा सरकारे पण आ जवानोने

नोकरीमां प्राथमिकता आपवानी जडेरत करी छे. जो के, अग्निपथ स्कीम सामे हरियाणा पलवल अने दिल्लीना नांगलोर्ध विस्तारमां भारे विरोध प्रदर्शन करवामां आवी रखा छे. गुरुवारे पलवलमां प्रदर्शनकारीओ रस्ता जाम करी दीधा डता. नांगलोर्धमां विद्यार्थीओअे ट्रेन रोकीने विरोध नोधाव्यो डतो अने योजनाने पाछी लेवा माटेनी मांग करी डती. भीज तरफ उत्तराखंडना पिथौरगढमां पण अग्निपथ योजनानो विरोध शुरु थयो डतो अने विद्यार्थीओ प्रदर्शन करी रखा डता. बिहारमां अग्निपथ स्कीनो विरोध करवा माटे रस्तामां उतरेला लोकोंने भाबुआ स्टेशन पर अेक ट्रेनमां आग यांपी दीधी डती. आ आग पर काभू मेणववाना प्रयासो करवामां आवी रखा छे. विरोधमां उतरेला लोकोंने पथरमारो करता स्थिति बेकाभू बनी डती, जेना पर काभू मेणववा माटे पोलीसे टियरगोसना सेल छोडया पडया डता.

अमेरिकामां मोंघवारी नियंत्रणमां लेवा उधामा
व्याजदरमां 0.75 टकानो वधारो

वोशिंग्टन
विश्व समग्र मोंघवारी सामे तमाम मोरये लडी रह्युं छे. विश्वनी सौथी मोटी अर्थव्यवस्था अमेरिकामां पण गर्थकाले रात्रे युअेस फेडरल रिजर्व अेटलेके सेन्ट्रल बैंक द्वारा व्याजदरमां 1.75% बाढनो सौथी मोटो व्याजदर वधारो करवानी फेरज पडी डती. गवर्नर पोवेले कह्युं डतु के मोंघवारीने डामवा माटे आगामी समयमां पण व्याजदर वधारो यालु रडेशे. जोके युअेस फेडरल रिजर्व डारठकना गणतरीना कलाकोमां ज स्वीस बैंके पण व्याजदरमां वधारो कर्यो छे. स्विजरलेन्डनी सेन्ट्रल बैंक, स्वीस नेशनल बैंक(अेसअेनबी)अे बेंचमार्क व्याजदरमां 1% वर्षमां प्रथम वधत वधारो कर्यो छे. देशमां वधती जती मोंघवारीने काभूमां लेवा माटे सेन्ट्रल बैंके मोनिटरि पोलीसीने कडक बनाववानो निर्णय कर्यो छे. सेन्ट्रल बैंके पोलीसी रेट वधारिने -0.05%थी वधारिने -0.25% कर्यो छे. 2014 बाढ व्याजदरमां आ फेरफार छे. व्याजदरमां आ वधारो जण्डम् द्वारा सप्टेम्बर, 2007 पछीनो प्रथम वधारो छे. व्याजदरमां वधारा छता अेसअेनबीअे मार्चमां आपेल मोंघवारीना 2.1%ना अनुमानने वधारिने 2.2% कर्यो छे. देशमां मोंघवारी 2023 अने 2024मां 1.5% अने 1.5% रडेवानी अपेक्षा सेवार्थ छे.

ABOWATH REAL ESTATE GROUP
VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

MAAZ ABOWATH
BROKER
416 893 4585
More info on PAGE 2
वय भाडिनी पाज 2 पज

ABOWATH.COM

SUPER VISA INSURANCE
Get Full REFUND if visa is declined
Get partial refund if parents leave early*
*conditions apply... Ask NOW for a free quote..

Sanjiv Puri
Insurance Broker
Ph.: 416-890-3232
Email: sanjivpuri@rogers.com

StarLife
Insurance & Investments Inc.
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

Closing down sale!
Japanese Sarees, UK Sweaters and much more at attractive prices.

Upto 80% off

\$1 each Blouse Piece • 3 for \$100 Gold Print Jacquard Sarees. • 4 for \$100 Gold Print Sarees. • 5 for \$100 UK Sweaters. • 10 for \$100 Printed Georgette Sarees. • 20 for \$100 Japanese Plain Suit Pcs and many more specials...

Biggest Sale Ever! Just in Time for the festive season!
Uma Sarees

6270 Côte des Neiges, Montreal
514-341-1394

Residential
New Condos
Investments
Commercial

दुरामां याए सभसो
Zakir Patel
Broker
Cell: 416-561-7973
Office : 416-287-2222

RE/MAX COMMUNITY
Realty Inc., Brokerage
Independently Owned and Operated
1265, Morningside Ave. #203
Toronto, ON M1B 3V9
Email : patelzakir2@gmail.com

छेला 78 वर्षथी टैरान्टीनी सर्व प्रथम गुजराती ट्रावेल अेजन्सी. 78 वर्षथी गुजराती प्रज अने गुजराती भाषा अमारी सकणता माटे यज्ञभागी छे. दिल्ली आपनी अमे प्रुबज आभार मानीअे छीअे. स्वाध मुसाहरी नी टिकीट माटे अमारा भाव टैरान्टीमां प्रुबज आकर्षक छे अजमावी बुओ... आपने आनंद यसे.

Ashok Travels 416-977-9896 अशोक ट्रावेलस ४१६ ९७७ ९८९९
Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

www.ashoktravel.com
Ashok Travels Serving your travel needs in Canada since 1973
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

SS & LAWYERS LLP

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

Avni Shah
B.A., JD
Barrister & Solicitor

ashah@sslawyers.ca
Tel : 416-818-4000
Fax : 416-740-4002

ઓન્ટેરિયોમાં કોવિડના 370 દર્દી હોસ્પિટલમાં, 42 વેન્ટિલેટર ઉપર

પ્રાંતમાં કોરોનાની ગતિ ધીમી પડી, ગયા અઠવાડિયે 419 કોવિડના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

ટોરોન્ટો

ઓન્ટેરિયોના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, કોવિડ -19ને કારણે થતા હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ છેલ્લા મહિનાઓમાં ઝડપથી ઘટી રહ્યું છે, ડિસેમ્બરથી શરૂ થયેલો ઘટાડાનો દોર હવે માત્ર 390 સુધી પહોંચ્યો છે. ઓન્ટેરિયોના આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ હાલમાં 370 દર્દીઓ કોવિડની સારવાર હેઠળ છે. જે ડિસેમ્બર, 2021ના આંક જેટલો જ છે. દરમિયાન આઈસીયુમાં દાખલ થવાનો દર વધીને 110થી 112 સુધી પહોંચ્યો છે. જો કે, બધી હોસ્પિટલો આંકડા વીકેન્ડ બાદ જાહેર કરતા ન હોવાથી સાચો આંક જાણવો મુશ્કેલ છે. જે દર્દીઓ હોસ્પિટલમાં છે એ પૈકી 7ને શ્વાસની તકલીફ છે, જેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે



ગયા અઠવાડિયે આ આંક 419થી વધુ હતો. ગયા અઠવાડિયે 419 કોવિડના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે પૈકી 111ને આઈસીયુમાં હતા. કુલ 677 પીસીઆર ટેસ્ટ છેલ્લા 24 કલાકમાં

થયા હતા. એ પૈકી 64 ટકાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. જે ગયા અઠવાડિયાના 9.1 ટકા અને બે અઠવાડિયા પહેલાના 8.6 ટકા કરતા ઓછો છે. હાલમાં ઓન્ટેરિયો પ્રાંતમાં કુલ 13,337 કેસ છે, જે પ્રાંતના અત્યાર સુધીના કુલ કેસના આંકને 1,392,778 સુધી પહોંચાડે છે. કેટલાક નિષ્ણાંતો અને મહામારીના અભ્યાસુઓના મતે હવે પ્રસારનો દર ધીમો રહેશે. ખાસ કરીને ઉનાળામાં ઘટશે, પણ ઠંડીની મોસમમાં એમાં થોડો વધારો થઈ શકે છે. આજે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા કોવિડ-19ના મરણના આંક મુજબ કુલ 13337 મૃત્યુ નોંધાયા છે. જેમાં ગયા અઠવાડિયાના 40નો પણ સમાવેશ થાય છે. હાલમાં 40 એક્ટિવ કેસ છે, જેમને લાંબા સમયની સારવાર માટે કેર હોમ્સમાં રાખવામાં આવ્યા છે.

વયસ્કો માટે ઓનલાઈન સીટીઝનશીપ એપ્લિકેશન્સ સ્વીકારવાનું શરૂ કરાશે

ટોરોન્ટો

ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સીટીઝનશીપ કેનેડા (આઈઆરસીસી) એ જાહેર કર્યું છે કે, યુગલો અને પરિવારો જેમના ઘણાં વયસ્ક સભ્યો હોય તેઓ સીટીઝનશીપ માટે ઓનલાઈન અરજી કરી શકશે. કેમ કે, વિભાગે એને માટેની તૈયારીઓ કરી લીધી છે અને આ વર્ષના પાનખર સુધીમાં એ શરૂ થઈ શકશે. અત્યારે પરિવાર દીઠ માત્ર એક વયસ્ક માટે અરજી ઓનલાઈન સ્વીકારવામાં આવતી હતી. જો કે, આ નવી વ્યવસ્થા શરૂ થવામાં થોડો સમય લાગશે એમ પણ વિભાગે જણાવ્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં વિભાગના

પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સગીરો અને પરિવારો માટેની આ વ્યવસ્થા પણ નવું પોર્ટલ બન્યા બાદ શરૂ થઈ શકશે. આઈઆરસીસી ઈ-એપ્લિકેશન્સનું પ્રમાણ વધારવાના પ્રયાસો કરે છે. શરૂઆતમાં 17 વર્ષ કે એથી વધુ વયજુથના વયસ્કો માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારી શકાશે. ત્યારબાદ એક જ પરિવારના એકથી વધુ સભ્યોના જુથ માટેની અરજીઓ પણ ઓનલાઈન સ્વીકારી શકાય એવી યોજના તૈયાર થઈ રહી છે. નવેમ્બર 2021માં આઈઆરસીસીએ પોતાની સિસ્ટમને અપડેટ કરીને આલએમએમ પઝૉલ હેઠળ અરજી કરવાની છૂટ આપી હતી.

કેનેડામાં જો વ્યાજદર વધશે તો ચારમાંથી એક ઘરમાલિકે ઘર વેચવું પડશે: સરવે

દર પાંચ પૈકી એક કેનેડીયન વ્યાજ વધારાની નકારાત્મક અસર હેઠળ

ટોરોન્ટો

મેન્યુલાઈફ બેંક ઓફ કેનેડાએ હાથ ધરેલા સરવેમાં એવું જાણવા મળ્યું છે કે, લગભગ ચારમાંથી એક ઘર માલિકે જો વ્યાજદર વધતો જશે તો ઘર વેચવાનો વારો આવી શકે છે. આ સરવે 17મી એપ્રિલથી 20મી એપ્રિલ વચ્ચે થયો હતો. જેમાં 17 ટકાથી વધુ મકાનમાલિકોએ કહ્યું હતું



કે, આ સમયે તેઓ મકાનના હમ્મલરી શકે એમ નથી. એટલે એ લોકો ઘર વેચવા માંગે છે. દર પાંચ પૈકી એક કેનેડીયન પણ વ્યાજ વધારાની નકારાત્મક અસર હેઠળ છે. કેમ કે, તેઓ લોન ભરવા સક્ષમ નથી એવું આ સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું. ધ બેંક ઓફ કેનેડાએ કુગાવાને ડામવા વ્યાજ

દર વધારવાનો રસ્તો અપનાવ્યો છે. જે છેલ્લા 39 વર્ષની સર્વોચ્ચ સપાટીએ એટલે કે 6.7 ટકાએ પહેલી જુન 2022ના રોજ પહોંચ્યો છે. જેની સામે કેનેડાની સેન્ટ્રલ બેંક મુખ્ય વ્યાજદરમાં અડધા ટકાથી દોઢ ટકા સુધીનો વધારો કર્યો છે. આ સરવેમાં એવું પણ જાણવા મળ્યું હતું કે, બે તૃતીયાંશ કેનેડીયનો માટે મકાનની માલિકી પોષણક્ષમ નથી. વધારામાં જેમણે ટેવું કરીને મકાન લીધું છે, તેઓ પણ આ વ્યાજદરના વધારથી હમ્મલરી શકે એમ નથી અને એની ચિંતા તેમના માનસિક આરોગ્ય પર અસર કરે છે.

ટોરોન્ટોમાં હુમલામાં દોષીને આજીવન કેદ, 2૫ વર્ષ સુધી પેરોલ નહીં મળે

2018ની ઘટનામાં આડેઘડ વાહન હંકારાતા આઠ મહિલાઓ અને બે પુરુષોના મૃત્યુ થયા હતા

ઓન્ટેરિયો

સોમવારે ટોરોન્ટોની સુપીરીયર કોર્ટના જસ્ટીસ એન મોલોયે એપ્રિલ 2021ના વાન હુમલાના દોષીને આજીવન કેદની સજા ફટકારી હતી અને 25 વર્ષ સુધી એને પેરોલ પણ નહીં મળે એવો ચુકાદો સંભળાવ્યો હતો. આ ચુકાદો આવ્યો ત્યારે હુમલાની ઘટનામાં ભોગ બનનારાઓના પરિવારના સભ્યો, મિત્રો અને સમાજના અનેક સભ્યો કોર્ટરૂમમાં હાજર હતા. દોષિત આરોપી એલેક મિસાઈઆનને હત્યાના પ્રયાસના 14 ગુનાઓ બદલ 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. એ ઉપરાંત ગયા વર્ષના એક હત્યાના કેસમાં પણ તે સામેલ હોવાથી એને આજીવન કેદની સજા આપવામાં આવી

હતી. 2017ની ઘટનામાં આઠ મહિલાઓ અને બે પુરુષોના મૃત્યુ થયા હતા. જ્યારે 25 વર્ષીય વ્યક્તિને એની સ્ત્રી મિત્રે ગુસ્સો અપાવતા એ ભાડાની વાન લઈને શહેરના વ્યસ્ત માર્ગ ઉપર આડેઘડ વાન હંકારતો રહ્યો હતો. જેને કારણે સર્જાયેલા અકસ્માતમાં આ મૃત્યુ થયા હતા. અન્ય મહિલાનું મૃત્યુ ઘટનાના દિવસે થયેલી ઈજાને કારણે ત્રણ વર્ષ બાદ થયું હતું. આ ઘટના અંગે જજ મોલોયે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે, આ માત્ર 25 વર્ષની સજા નથી. પરંતુ ગુનો બન્યાના 25 વર્ષ બાદ જ એ પેરોલની અરજી કરી શકશે. એટલે કે, 25 વર્ષ સુધી પેરોલ વિના સજા ભોગવવી પડશે. તેમણે આ ઘટનાના સાક્ષીઓને નિવેદન આપવા બદલ બિરદાવ્યા હતા. આખો દિવસ ચાલેલી સુનાવણીમાં તેમણે બધાને સાંભળ્યા બાદ ચુકાદો આપ્યો હતો. આ ઘટનામાં ભોગ બનનારા બધા નિર્દોષ હતા અને સાંજે ચાલવા નિકળેલા લોકો હતા.

ટૂડો બીજી વાર કોરોના વાયરસથી સંક્રમિત

ઓન્ટેરિયો

કેનેડાના વડાપ્રધાન ટૂડોએ સોમવારે ટવીટ કરીને જણાવ્યું હતું કે, તેઓ બીજીવાર કોવિડ -19 ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. એટલે હવે જાહેર આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાને અનુસરીને આઈસોલેશનમાં રહેશે. ગયા અઠવાડિયે ટૂડોએ લોસ એન્જલસમાં અમેરિકનોની એક બેઠકમાં હાજરી આપવા ગયા હતા. જ્યાં એ અમેરિકન પ્રમુખ જો બાઈડન સહિત અનેક મહાનુભાવોને મળ્યા હતા. જો કે, તેમણે કહ્યું હતું કે, હવે તેમને સારું છે અને વેકસીન પણ લઈ લીધી છે. આમ છતાં ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાથી હવે આઈસોલેશનનું પાલન કરશે.

સોમવારની રાત્રે ટૂડોને ઓટાવામાં લિબરલ ડોનરના કાર્યક્રમમાં સંબોધન કરવાનું હતું. પણ પછીથી એમને બદલે ડેબ્યુટી પ્રાઈમ મિનીસ્ટર ક્રિસ્ટીયા ફ્રીલેન્ડે સંબોધન કર્યું હતું અને બધી વેકસીન લીધી હોય, એવી પાર્ટીના સભ્યો સાથે સંવાદ સાધ્યો હતો. જાન્યુઆરી બાદ વડાપ્રધાન બીજીવાર ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. આ અગાઉ માર્ચ 2020માં એ વાઈરસના ભોગ બન્યા હતા અને 14 દિવસનું આઈસોલેશન પાળ્યું હતું. જો કે, ત્યારબાદ ડીસેમ્બર 2021થી એ નિયમિત ટેસ્ટ કરાવતા આવ્યા છે. એમના સ્ટાફના કેટલાક સભ્યો અને સુરક્ષાકર્મીઓના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા હતા.

THINKING OF BUYING, SELLING OR INVESTING?

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર

અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટ ની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.
મોર્ટગેજ જોઈએ છે? અમે મદદ કરી શકીએ છીએ!

CALL 416 893 4585 TODAY!!!

SUBHRO CHAKRABORTY
SALES REPRESENTATIVE

SUDHIR PARMAR
SALES REPRESENTATIVE

Call us **TODAY** for all of your Real Estate needs and get honest, reliable and professional Service you can count on.

- Residential
- New Construction
- Investment
- Commercial

MOHAMMAD ABOWATH
SALES REPRESENTATIVE

MAAZ ABOWATH
BROKER - TEAM LEADER

IBRAHIM ABOWATH
SALES REPRESENTATIVE

416 893 4585

ABOWATH

REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

RE/MAX #1 with ABOWATH your Local REALTOR

તંત્રી સ્થાનેથી

હેરાલ્ડ કેસ : સોનિયા-રાહુલની શાખ બચાવવા કોંગ્રેસીઓના હવાતિયા

ભારતમાં આજકાલ નેશનલ હેરાલ્ડ કેસનો મુદ્દો ફરી ગાજવા માંડ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવતા જ તેના પડઘા રાજકીય ગલિયારામાં પડ્યા છે. આ કાર્યવાહી સામે દેશભરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું, કોંગ્રેસે આરોપ મુક્યો કે, આ કાર્યવાહી રાજકીય કીત્તાખોરીથી થઈ રહી છે.



તંત્રી - પ્રકાશક સ્વદેશ

સામાન્ય સંજોગોમાં દેશના કોઈ પણ નાગરિક સામે ફોજદારી કેસ થાય અને તેની પૂછપરછ કરવામાં આવે તે સામાન્ય ઘટના ગણાવી જોઈએ, પણ ભારતમાં છેલ્લાં બે દાયકામાં નેતાઓને હેરાન કરવા સરકાર દ્વારા આઈટી, ઈડી સહિતની એજન્સીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઈડી દ્વારા થનારી પૂછપરછને ટાળવા પહેલાં સોનિયા અને રાહુલે કોરોનાનું બહાનું કાઢ્યું. પછી સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. રાહુલ ગાંધીની પહેલા દિવસે ૧૦ કલાક પૂછપરછ થયા પછી કામ બાકી રહ્યું તો તેમને બીજા દિવસે પણ બોલાવવામાં આવ્યા હતા.

ઈડીના અધિકારીઓ પોતાની ફરજ બજાવી રહ્યાનો દાવો કરે છે, તો બીજી બાજુ કોંગ્રેસના કાર્યકરોને લાગે છે કે તેમના નેતાને હેરાન કરવા જ આ કાર્યવાહી થઈ રહી છે. હકીકતમાં નેશનલ હેરાલ્ડ કેસને સમજવો પણ આવશ્યક છે. આઝાદીની લડત દરમિયાન બ્રિટીશ રાજનો વિરોધ કરવા અનેક વર્તમાનપત્રો ચાલુ થયા, તેમાં નેશનલ હેરાલ્ડ પણ એક અખબાર હતું.

નેશનલ હેરાલ્ડનો પ્રારંભ ૧૯૩૮માં કરાયો હતો અને તેના પહેલા તંત્રી પંડિત જવાહરલાલ નેહરુ હતા. નેશનલ હેરાલ્ડની માલિકી એસોસિયેટેડ જર્નલ લિમિટેડ નામની કંપનીને સોંપાઈ હતી, જેના માલિકો તેના ૫,૦૦૦ શેરહોલ્ડરો હતા. ભારતને આઝાદી મળી તે પછી નેશનલ હેરાલ્ડ અખબાર કોંગ્રેસ પક્ષનું મુખપત્ર બની ગયું. તેની ઉર્ફૂ આવૃત્તિ 'કૌમી આવાજ'ના નામે અને હિન્દી આવૃત્તિ 'નવજીવન'ના નામે શરૂ થઈ. જ્યારે દેશને આઝાદી મળવા સાથે જવાહરલાલ નેહરુ ભારતના વડાપ્રધાન બનતા તેમણે નેશનલ હેરાલ્ડના ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું. પરંતુ તે પછી પણ તેનો વહિવટ કોંગ્રેસના હાથમાં રહ્યો. ૨૦૦૮માં નેશનલ હેરાલ્ડ બંધ થઈ ગયું. આ સમયે તેના માથે ૮૦.૨૫ કરોડ રૂપિયાનું દેવું હતું. નેશનલ હેરાલ્ડના માથે જે ૮૦.૨૫ કરોડ રૂપિયાનું દેવું હતું તે રકમ તેને કોંગ્રેસ પક્ષ દ્વારા વ્યાજમુક્ત લોનના રૂપમાં આપવામાં આવી હતી. નેશનલ હેરાલ્ડ પાસે ૮૦.૨૫ કરોડ રૂપિયાનાં દેવાં સામે ચળ-અચળ મિલકતો પણ હતી. જેની બજારકિંમત આશરે ૨,૦૦૦ કરોડ રૂપિયા હતી. ૨૦૧૦માં નેશનલ હેરાલ્ડને ફરી શરૂ કરવા માટે યંગ ઈન્ડિયા લિમિટેડ નામની નવી કંપનીનું ગઠન કરાયું, જેના અધ્યક્ષ રાહુલ ગાંધી હતા. તેના બીજા ડિરેક્ટરોમાં સોનિયા ગાંધી, ઓસ્કાર ફર્નન્ડિઝ, મોતીલાલ વોરા, સુમન દુબે, સામ પિત્રોડા વગેરેને સ્થાન અપાયું.

૨૦૧૦માં નેશનલ હેરાલ્ડની હોલિડિંગ કંપની એસોસિયેટેડ જર્નલ લિમિટેડના માત્ર ૧૦૫૭ શેરહોલ્ડરો હયાત હતા, જેમાં ભૂતપૂર્વ કાયદા પ્રધાન શાંતિભૂષણનો અને મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ માર્કેડેય કાન્જૂનો પણ સમાવેશ થતો હતો. ૨૦૧૧માં આ ૧૦૫૦ શેરહોલ્ડરોને પૂછ્યા વિના તેમના શેરો નવી બનેલી કંપની યંગ ઈન્ડિયા લિમિટેડ કંપનીના નામે ટ્રાન્સફર કરાયા. એસોસિયેટેડ જર્નલ કંપનીને માથે જે ૮૦.૨૫ કરોડનું દેવું હતું તે નવી કંપનીના માથે ટ્રાન્સફર કરાયું.

તેની સાથે નેશનલ હેરાલ્ડની ૨,૦૦૦ કરોડની

સંપત્તિ પણ નવી કંપનીના હાથમાં આવી ગઈ. નવી કંપનીએ ૮૦.૨૫ કરોડ રૂપિયાના દેવાં સામે માત્ર ૫૦ લાખ રૂપિયાની ચૂકવણી કરી. કોંગ્રેસ પક્ષ દ્વારા બાકીના ૮૯.૪૫ કરોડ રૂપિયા ઉદારતાથી માફ કરી દેવાયા. ભારતીય જનતા પક્ષના નેતા સુબ્રમણ્યમ સ્વામીના ધ્યાનમાં આ ગોટાળો આવ્યો. જે બાદ તેમણે આ કૌભાંડને ઉજાગર કર્યું. ૨૦૧૨માં તેમણે દિલ્હીની એક ટ્રાયલ કોર્ટમાં યંગ ઈન્ડિયા લિમિટેડના ડિરેક્ટરો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, સુમન દુબે વગેરે વિરુદ્ધ નાણાકીય ઉચાપતની ફરિયાદ દાખલ કરાવી. સુબ્રમણ્યમ સ્વામીના દાવા મુજબ યંગ ઈન્ડિયા લિમિટેડ કંપની માત્ર પાંચ લાખ રૂપિયાની મૂડી સાથે શરૂ થઈ હતી. તેણે કોલકાતાની બોગસ કંપની ડોટેક્સ મર્કેન્ડાઈઝ પાસેથી ૧ કરોડ રૂપિયાની લોન લીધી હતી. તેમાંથી ૫૦ લાખ રૂપિયા તેણે કોંગ્રેસ પક્ષને ૮૦.૨૫ કરોડ રૂપિયાના દેવાં સામે ચૂકવી દીધા હતા. કોંગ્રેસ પક્ષે બાકીના ૮૯.૦૫ કરોડ રૂપિયા માફ કરી દીધા હતા. આ કંપનીના ડિરેક્ટરો કોંગ્રેસ પક્ષના નેતાઓ હતા, જેમણે પોતાની મોટી મૂડી તેમાં રોકી નહોતી. સુબ્રમણ્યમ સ્વામીના દાવા મુજબ કોંગ્રેસ પક્ષને કોઈ પણ કંપનીને ૮૦.૨૫ કરોડ રૂપિયાની લોન આપવાનો જ અધિકાર નહોતો. કારણ કે, ઈન્કમ ટેક્સના કાયદા મુજબ રાજકીય પક્ષને મળેલું દાન ઈન્કમ ટેક્સથી મુક્ત હોય છે. તેઓ કોઈ ત્રીજી પાર્ટીને દાન આપી શકતા નથી.

કોંગ્રેસે નેશનલ હેરાલ્ડને આપેલી લોન માફ કરી હોવાથી તેણે દાનનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વળી કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા નેશનલ હેરાલ્ડને આપવામાં આવેલી ૮૦.૨૫ કરોડની લોન પૈકી ૮૯.૦૫ કરોડની લોન માફ કરીને તેમણે ૨,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ ઉપર કબજો જમાવી દીધો હતો. સામે પક્ષે કોંગ્રેસનો બચાવ એવો છે કે નેશનલ હેરાલ્ડની સંપત્તિ કોંગ્રેસ પક્ષની સંપત્તિ હતી, કારણ કે તે પક્ષનું મુખપત્ર હતું. ૨૦૧૦માં જે યંગ ઈન્ડિયા લિમિટેડ નામની કંપની ઊભી કરાઈ તે પણ કોંગ્રેસ પક્ષની પેટાસંસ્થા જેવી હતી. તેનો ઉદ્દેશ નેશનલ હેરાલ્ડને ફરી શરૂ કરવાનો હતો. ૨૦૧૬માં તેણે નેશનલ હેરાલ્ડને બદલે બીજાં ત્રણ મેગેઝિનો શરૂ પણ કર્યાં હતાં.

જ્યારે આ અંગે સુબ્રમણ્યમ સ્વામી કહે છે કે, જો કોંગ્રેસના નેતાઓ નેશનલ હેરાલ્ડ ફરીથી શરૂ કરવા માગતા હતા તો તેમણે નવી કંપની શરૂ કરવાની શું જરૂર હતી? તેઓ જૂની કંપનીના નામે પણ તે કામ કરી શકતા હતા. ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપના મોરચાની સરકાર આવી તે પછી તરત જ સુબ્રમણ્યમ સ્વામીના કેસમાં દિલ્હીની ટ્રાયલ કોર્ટ દ્વારા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી વગેરેને સમન્સ મોકલવામાં આવ્યાં. કોંગ્રેસના નેતાઓ તેની સામે દિલ્હી હાઈકોર્ટમાં ગયા. દિલ્હી હાઈ કોર્ટે સમન્સ કેન્સલ કર્યાં. તે જ વર્ષે ઈડી દ્વારા મની લોન્ડરિંગના આક્ષેપોની તપાસ શરૂ કરાઈ.

૨૦૧૬માં સુપ્રિમ કોર્ટે કોંગ્રેસના પાંચ નેતાઓ સામે ચાલતો કેસ સ્થગિત કરવાનો ઈન્કાર કર્યો, પણ તેમને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી. ઈન્કમ ટેક્સ વિભાગે રાહુલ ગાંધીને નોટિસ મોકલી કે તેમની પાસે જે યંગ ઈન્ડિયા લિમિટેડના શેરો છે, તેમાં ૧૫૪ કરોડ રૂપિયાનો નફો થયો હોવાથી તેમણે ૨૪૯.૧૫ કરોડ રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે. આ બાજુ કેન્દ્ર સરકારે દિલ્હીમાં નેશનલ હેરાલ્ડનું લીઝ કેન્સલ કર્યું છે. તેનું મકાન ખાલી કરાવવા સામે સુપ્રિમ કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે. કોંગ્રેસના નેતાઓ આ કૌભાંડમાં ખરેખરા ભેરવાઈ ગયાનું લાગે છે. તેને કારણે ગાંધીપરિવારની શાખ ન બગડે તે માટે દેશભરમાં કોંગ્રેસીઓ વિરોધ પ્રદર્શન કરીને હવાતિયા મારી રહ્યા છે.

મનોજ ગાંધી

manoj1968@yahoo.ca

ARISTO PEST CONTROL
Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com



✓ Mice
✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL



✓ Cockroach
✓ Bedbug
✓ Animal Control
✓ Bird Control
✓ WASPS and
✓ Hive Removal

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI



24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

Written Guarantee And Discounted Rates



CALL SANKET TRIVEDI - 647.339.3926
Government Licensed Structural Exterminator



DIVINE YOGA



By Geeta

Children Yoga Class

Every Tuesday 5-6 PM

Adult Yoga Class

Every Saturday 9-10 AM

Join-today-on-ZOOM!

: Classes Available :
One to One Individual
and Therapeutic

Geeta Tailor
416-456-2261

Contact Geeta at
divineyogabygeeta@gmail.com
IG & FB: @divineyogabygeeta



બનાસકાંઠામાં પુત્રીની સગાઈ તૂટી તો માતાએ યુવાન સાથે જ સંસાર માંડ્યો

બનાસકાંઠા

બનાસકાંઠાના એક બનાવે રાજ્યમાં ખૂબ ચર્ચા જગાવી છે. દીકરીની જે યુવક સાથે સગાઈ થઈ હતી તે યુવક સાથે માતાએ ઘર માંડી લીધું છે! આ કિસ્સામાં સમાજના આગેવાનો અને અભયમ તરફથી મહિલાને પરત પોતાના ઘરે લઈ જવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ૧૮૧ અભયમ હેલ્પલાઈન નંબર પર મદદ માટે એક કોલ આવ્યો હતો. જેમાં મહિલાએ ફરિયાદ કરી હતી કે તેનો પતિ તેના પર ત્રાસ ગુજારે છે. મહિલાની ફરિયાદ બાદ અભયમનો સ્ટાફ પોલીસ સાથે ફોન કરનાર મહિલાના ઘરે પહોંચ્યો હતો. અહીં મહિલાની વાત સાંભળીને ખુદ અભયમનો સ્ટાફ આશ્ચર્યમાં મૂકાયો હતો. હકીકતમાં અભયમ પાસે મદદ માંગનાર મહિલાની ઉંમર ૪૬ વર્ષની હતી. મહિલાના પતિનું વર્ષો પહેલા મૃત્યું થયું હતું. મહિલા પોતાના સંતાનો સાથે જીવન ગુજારી રહી હતી. આજથી ચાર વર્ષ પહેલા એક યુવક મહિલાની દીકરીને જોવા માટે

આવ્યો હતો. જે બાદમાં બંનેનું સગપણ નક્કી કરવામાં આવ્યું હતું. કોઈ કારણસર મહિલાની દીકરી અને યુવકનું સગપણ અઢી મહિના જ ચાલ્યું હતું. જે બાદ દીકરીનું જે યુવક સાથે સગપણ થયું હતું તે ૩૦ વર્ષીય યુવક સાથે તેની માતાએ લગ્ન કરી લીધા હતા. મહિલાની વાત સાંભળીને અભયમની ટીમે તેમને પોતાના સંતાનો પાસે પરત જવા માટે સજાવ્યા હતા.

મહિલાને પોતાના પ્રથમ પતિથી ત્રણ દીકરી અને એક દીકરો છે. હાલ મહિલાના ચારેય સંતાનો તેના દાદી સાથે રહે છે. આ કેસમાં હવે અભયમની ટીમ અને સામાજિક અગ્રણીઓએ મહિલાને સમજાવીને પોતાના સંતાનો પાસે પરત લઈ જવાની તજવીજ હાથ ધરી છે. અભયમની સમજાવટ બાદ મહિલા પોતાના સંતાનો પાસે પરત જવા માટે તૈયાર થઈ ગઈ છે. મહિલા છેલ્લા ચાર વર્ષથી યુવક સાથે રહેતી હતી. બંનેએ એક મંદિરમાં ફૂલહાર કરી લીધા હતા.

PM નરેન્દ્ર મોદીનાં માતા હિરાબા 18મીએ શતાયુ વર્ષમાં પ્રવેશ કરશે

ગાંધીનગર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબા ૧૮મી જૂન ૨૦૨૨ના રોજ ૧૦૦મો જન્મદિવસ મનાવશે. આ પ્રસંગે તેમના વતન વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રે ૭.૩૦ કલાકે આ ઉજવણી કરાશે. ૧૮મી જૂન ૧૯૨૩માં જન્મેલા હિરાબા ૧૮મીએ શતાયુમાં પ્રવેશ કરી રહ્યાં છે.

મોદીના માતાના દિર્ઘાયુ અને તેમની તંદુરસ્તી માટે સુંદરકાંડ, શિવ આરાધના અને ભજનસંસ્થાનો ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. વડનગરના મંદિરમાં સુંદરકાંડના

પાઠ કેતન કામલે કરશે. ભક્તિ ભજન જીતુ રાવલ કરશે. શિવ આરાધના અનુરાધા પૌડવાલ કરશે અને લોકહાસ્ય માટે ગુણવંત ચૂડાસમાને બોલાવવામાં આવ્યા છે. સંગીતનું નિયોજન પંકજ ભટ્ટને સોંપવામાં આવ્યું છે.

મોદીના માતાની ઉજવણીમાં સહભાગી થવા માટે હાટકેશ્વર મહાદેવ મંદિર સંસ્થાન તેમજ સમસ્ત વડનગરના નગરજનોએ સ્નેહીજનોને આમંત્રણ આપ્યાં છે. માતાના આ જન્મદિને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હોવાથી તેઓ તેમને મળવા જાય તેવી સંભાવના પણ છે.

Imperial PEST CONTROL

Residential • Commercial • Industrial

24 Hour Service • 7 Days a Week



Preventing the Spread of COVID-19 : Our disinfectant services that we offer are:


- 1 Spray Services
- 2 Fogging Services
- 3 Sanitation Services

All Pest Control:

Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants. Total Interior & Exterior Pest Control

Removal:

Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornets, Yellow Jackets



Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca
info@imperialpestcontrol.ca
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820

ગોવર્ધનજાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી, છોલેપુરી, કટલેસ, ખાસ્તા કચોરી, સેવ ઉસળ, સમોસા ચાટ

Takeout & Catering

Limited થાળી
(with sweet & Farsan)
\$9.00 +Tax

Limited થાળી
(without sweet & Farsan)
\$7.50 +Tax



CATERING SPECIAL

\$ 14.99 10 items
+Tax
Sweet, Farsan, Subji, Kathor, Puri, Dal, Rice Papad, Pickle, Kachumber

Franchise Opportunity in GTA

Call us for details

રસોઈકામ કરી શકે તેવા બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

વડોદરામાં સવા બે વર્ષમાં ૬૨૫ આત્મહત્યા

આપઘાત કરનારાઓમાં 420 પુરુષો અને 171 મહિલાઓનો સમાવેશ

વડોદરા

વડોદરા શહેરમાં વર્ષ-૨૦૨૦થી ૨૦૨૨ના માર્ચ સુધીમાં કુલ ૬૨૫ લોકોએ વિવિધ કારણોસર જીવન ટૂંકાવ્યું હોવાની વિગત બહાર આવી છે. સવા બે વર્ષ સુધી શહેર પોલીસના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા આત્મહત્યાના બનાવોમાં પુરુષોની સંખ્યા વધારે છે.

વર્ષ-૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૨ના માર્ચ માસ સુધી શહેર પોલીસ કમિશનરની હદમાં આવતા પોલીસ સ્ટેશનો દ્વારા પુરુષ અને

સ્ત્રીઓએ કરેલી આત્મહત્યાની વિગતો પૂરી પાડવામાં આવી હતી.

વડોદરા શહેર પોલીસ કમિશનરની હદમાં આવતા કુલ ૨૧ પોલીસ સ્ટેશનોમાં માંજલપુર પોલીસ સ્ટેશનને બાદ કરતા ૨૦ પોલીસ સ્ટેશનોમાં કુલ ૬૨૫ લોકોએ પોતાની જીવનલીલા સંકેલી હોવાના કેસો નોંધાયા છે. જેમાં ૧૮ પોલીસ સ્ટેશનોમાં ૪૨૦ પુરુષો અને ૧૭૧ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. સૌથી વધુ હરણી, મકરપુરા, ગોરવા, બાપોદ, ગોત્રી, પાણીગેટ પોલીસ સ્ટેશનોમાં આત્મહત્યાના

કેસો નોંધાયા છે. અપ્રિય ઘટનાઓ ના બને તે માટે સરકારે લોકોની સમસ્યાને જાણવા, સમજવાની અને તેને ઉકેલવાની જરૂર છે તેમ જણાવી આરટીઆઈ એક્ટિવિસ્ટે જણાવ્યું હતું કે લોકોના આત્મહત્યા કરવા માટેના કારણોમાં બેરોજગારી, મોંઘવારી, ભાવવધારો, ડિપ્રેશન, ઘરકંકાસ તેમજ પ્રેમપ્રકરણ જવાબદાર છે. લોકોની સમસ્યાઓ વધતી જાય છે અને તેની સામે સહનશક્તિ ઘટતી હોવાથી લોકો ક્ષણિક આવેગમાં આત્મહત્યાનું પગલું લે છે.

વડોદરા- બુલેટ પર જતી પ્રેમિકા અને તેના પતિ પર પ્રેમીએ કાર ચડાવી દીધી

વડોદરા

કપુરાઈગામ નજીક રહેતો મહેશ ભીખાભાઈ પ્રજાપતિ જામનગર ખાતે રિલાયન્સ કંપનીમાં ફિલ્ડ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. તેના લગ્ન કિશનવાડી ઝંડાચોકમાં રહેતી આશા સાથે ૧૦ વર્ષ પહેલાં થયા હતાં. લગ્ન બાદ પતિ અને પત્ની બંને બે સંતાનોના વાલી બન્યા છે. મહેશ ૧૫ દિવસનું વેકેશન લઈ વડોદરા ખાતે રહેવા માટે પરિવાર સાથે આવ્યો છે.

રાત્રે મહેશ ઘરના સભ્યો સાથે ધાબા પર ઊંઘી ગયો હતો અને વહેલી સવારે કૂતરા ભસવાનો અવાજ આવતા તે જાગી જતા પોતાના ઘરમાં તેની પત્ની

તેમજ કિશનવાડી ઝંડાચોકમાં રહેતા ચેતન વિપુલ ચૌહાણ બંનેને સાથે જોયા હતાં. પરંતુ મહેશ ચેતનને રવાનો કર્યો હતો. ચેતન અને આશાના સંબંધો અંગે મહેશને વારંવાર પત્ની સાથે ઝગડો પણ થતો હતો. દરમિયાન મહેશ તેની પત્ની આશા સાથે બુલેટ લઈને બહાર નીકળ્યા હતા ત્યારે રોડ પર સામેથી પૂરપાટઝડપે મરુન કલરની એક કારે આવીને બુલેટ સાથે અથાડતા મહેશ અને તેની પત્ની બંને રોડ પર પટકાતા લોકો ભેગા થઈ ગયા હતા અને કારના ચાલકને બહાર કાઢતા તે ચેતન ચૌહાણ હોવાનું જણાયું હતું. ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

8 લાખના પાર્ટી ડ્રગ્સ સાથે પકડાયેલી ગેંગ 7 દિવસના રિમાન્ડ પર

વડોદરા

મધ્યપ્રદેશથી કારમાં લવાઈ રહેલા પાર્ટી ડ્રગ્સ સાથે પકડાયેલી ગેંગને રિમાન્ડ પર લઈ નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે. આ માટે પોલીસની ટીમ મધ્યપ્રદેશ રવાના થશે. મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો લઈ કારમાં નીકળેલા બિચ્છુ ગેંગના તનવીર ઉર્ફે તન્નુ તેમજ તેની સાથે મુંબઈની મધુમિતા ઉર્ફે અનામિકા, પાથ સરદાર અને શહેબાજ પટેલને એસઓજીની ટીમે ગોલ્ડન ચોકડી પાસે ઝડપી પાડતાં મહિલા પાસેથી મેકેડોનનો રૂ. ૮ લાખની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજીના પીઆઈ સી બી ટંડેલે આજે તમામ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા.

આણંદમાં 6 વર્ષ અગાઉની ફરિયાદમાં 8 કાઉન્સિલર સહિત 18 ને કોર્ટનું તેડું

આણંદ

લગભગ છ વર્ષ પૂર્વે પાલિકા હસ્તકના નવા બસ સ્ટેન્ડ નજીકના કોમર્શીયલ સંકુલની વધારાની જગ્યાનો બારોબાર પાલિકાના શાસકો દ્વારા સત્તાનો દુરુપયોગ કરી વહીવટ કરવા મુદ્દે એસીબીમાં દાખલ થયેલ ફરિયાદ સંદર્ભે પાલિકાના પૂર્વ પ્રમુખ તથા સી.ઓ. સહિત જે-તે સમયના પાલિકાના આઠ કાઉન્સિલર સહિત ૧૮ વ્યક્તિઓને કોર્ટનું તેડું આવતા પુનઃ મુદ્દો ચર્ચાની એરણે ચઢ્યો છે.

નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી પાલિકા હસ્તકના કોમર્શીયલ સંકુલની વધારાની જગ્યા વર્ષ ૨૦૧૫માં પાલિકાના પૂર્વ

કાઉન્સિલરો દ્વારા સત્તાનો દુરુપયોગ કરી કોર્ટપણ જાતની પ્રક્રિયા કર્યા સિવાય વેપારીઓને વધારાની જગ્યા ફાળવી આપી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવા મુદ્દે આણંદના એક જાગૃત નાગરિક દ્વારા એસીબીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સાથે સાથે આ મુદ્દે જે-તે સમયના કાઉન્સિલરો વિરૂધ્ધ પાલિકા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી. જે સંદર્ભે એસીબી દ્વારા તપાસ હાથ ધરી પાલિકા કમિશનર ગાંધીનગરને ખોટું થયાના પગલે પાલિકાના શાસક સહિત અન્ય વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચન કરવામાં આવ્યું હતું.

મોદી રેલવેના 16369 કરોડના 18 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર: મોદીની ઉપસ્થિતિમાં આગામી તા.૧૮ જૂન, ૨૦૨૨ ના રોજ વડોદરામાં કાર્યક્રમ યોજનાર છે. આ કાર્યક્રમમાં મોદીના હસ્તે ગુજરાતમાં રેલવેના વિવિધ રૂ.૧૬,૩૬૯ કરોડના ૧૮ પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. પીએમ મોદીના હસ્તે રેલવેના વિવિધ રૂ.૧૦૭૪૯ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પાંચ પ્રોજેક્ટનું લોકાર્પણ થશે આ ઉપરાંત રૂ.૫૬૨૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ ૧૩ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. પીએમ મોદી વડોદરામાં રૂ. ૫૭૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર ભારતીય ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના નવા ભવનનો પણ શિલાન્યાસ કરશે. કેન્દ્ર સરકાર વડોદરા સ્થિત રાષ્ટ્રીય રેલવે પરિવહન સંસ્થાનું નામ બદલીને ભારતીય ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય કરવા જઈ રહી છે.



UNLOCK HIDDEN GEMS IN REAL ESTATE

CALL US TO FIND PROPERTY WITH POSITIVE CASH FLOW


ZIVASA
 Realty Inc., Brokerage

 647.972.1000

www.zivasa.com



Bhagat Dhull



Bharat Batra



Harit Gaba



Himanshu & Anshu Batta



Rajiv Arora



Rajesh Khurana
 Broker

બોરસદમાં રોડ બનાવવા મુદ્દે અથડામણ 2 હજારથી વધુના ટોળાં સામે ફરિયાદ

પોલીસ દ્વારા 44 વ્યક્તિઓની નામજોગ ફરિયાદ નોંધાઈ : ધરપકડની કાર્યવાહી શરૂ કરી દેવાઈ

આણંદ

બોરસદ શહેરના હનુમાન મંદિરની પાછળ આવેલ એક પ્લોટ ઉપર વાવડી મહોલ્લામાં રહેતા કેટલાક લઘુમતી કોમના રહીશો દ્વારા આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા મંદિરે આવેલ ભક્તોએ તેનો વિરોધ કર્યો હતો. જેને લઈ મામલો ગરમાયો હતો અને શનિવાર રાત્રિના સુમારે આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલ એક યુવકને કેટલાક શખ્સોએ રોકી ચપ્પા વડે હુમલો કર્યો હતો. બાદમાં

સમગ્ર મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને બંને કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કર્યો હતો. કેટલાક તોફાની તત્વો દ્વારા આ વિસ્તારમાં આવેલ દુકાનોની તોડફોડ કરવામાં આવતા બોરસદ શહેર પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તોફાની તત્વો બેફામ બનતા આણંદ જિલ્લા ડીએસપી, એલસીબી, એસઓજી સહિત અન્ય પોલીસ મથકના અધિકારીઓ તથા પોલીસકર્મીઓ બોરસદ ખાતે દોડી

ગયા હતા. જો કે ટોળાએ હાઈવે ઉપર ચક્કાજામ કરી મોટરસાયકલ ઉપર પસાર થઈ રહેલ બે યુવકોને આંતરી ચપ્પા વડે હુમલો કર્યો હતો. આ બંને યુવકોને તુરત જ સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. રાત્રિના સુમારે બનેલ આ ઘટનાના પડઘા બોરસદ શહેરના બ્રાહ્મણવાડો, વાવડી મહોલ્લા, કોલેજ રોડ, ડો. ઠક્કરના દવાખાના નજીક, નારણદેવ મંદિર પાસે, કાશીપુરા જૈન મંદિર પાસેના વિસ્તારમાં પડયા હતા અને ભારે તંગદિલી વ્યાપી હતી.

ડાકોરમાં પૂનમે ભાવિકો ઉમટી પડયા



ડાકોર : યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિરે મંગળવારે જેઠ સુદ પૂનમના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ઠાકોરજીના દર્શન માટે મંગળા આરતીથી સાંજની આરતી સુધી ડાકોરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. મંગળા આરતી બાદ ઠાકોરજીને સોમવારે લવાયેલા ગોમતીજીના નીરમાં ગુલાબ, મોગરો, જુઈ, ખસ, ઈત, બરાસ, કેસરથી વેદોક્ત મંત્રોચ્ચારથી સ્નાન કરવામાં આવ્યું હતું. મંદિરમાં પરંપરા મુજબ ભગવાનને જયેષ્ઠ સ્નાન કરાવી ઉજવવામાં આવે છે.

વડોદરા ખાતે બ્રેનડેડ કોમ્પ્યુટર એન્જિનિયરના પાંચ અંગોનું દાન કરાયું

વડોદરા

વડોદરામાં રહેતા ૫૧ વર્ષના પ્રજ્ઞોશભાઈ ભટ્ટ કોમ્પ્યુટર કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. બે અઠવાડિયા પહેલા તેઓની તબિયત બગડતા હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. રિપોર્ટ દરમિયાન પ્રજ્ઞોશભાઈને બ્રેન ટ્યૂમર હોવાનું નિદાન થયું હતું. દર્દીને ૯ મી તારીખે બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. દર્દીના પરિવારજનોને ડોક્ટરની ટીમ દ્વારા ઓર્ગન ડોનેશન માટે માહિતી આપવામાં આવતા પરિવારજનો ઓર્ગન ડોનેશન માટે તૈયાર થયા હતા. જે બાદ દર્દીની બે કિડની, લિવર અને બે આંખોને શિક્ષિત પૂર્વક કાઢી અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા હતા. ઓર્ગન ડોનેશન થકી પાંચ દર્દીઓને નવું જીવન મળશે.

ઉમરેઠ પાલિકાના 4 સભ્યોએ સમાધાન કરી લેતા અંતે ધીના ઠામમાં ઘી ભળ્યું

આણંદ

ઉમરેઠ નગરપાલિકાના સત્તાધારી પક્ષ ભાજપના છ સભ્યોએ જે-તે કમિટીઓના ચેરમેન પદેથી તથા એકે સભ્યપદેથી આપેલા રાજીનામાનો મુદ્દો શહેરભરમાં ચર્ચાની એરણે ચઢ્યા બાદ મંગળવારે રાત્રિના સુમારે સાત કાઉન્સિલરો પૈકી ચાર કાઉન્સિલરો સાથે સમાધાન થતા ધીના ઠામમાં ઘી ભળ્યું હોવાની વાતો વહેતી થઈ છે. જો કે અન્ય ત્રણ કાઉન્સિલરોને આ મામલે બોયકોટ કરાયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

શહેરના જાગૃતોમાં ઉઠેલી ચર્ચાઓ મુજબ ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખની કાર્યપદ્ધતિ સામે પક્ષના જ કાઉન્સિલરોમાં

છેલ્લા કેટલાક વખતથી અસંતોષની લાગણી વ્યાપી હતી. જેમાં સાત સભ્યોએ આપેલા રાજીનામા પાછળનું કારણ છેલ્લા એક વર્ષ ઉપરાંતથી વિકાસના કામો અટકી પડયા છે તેમાં પ્રમુખની નીતિ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ મામલે જો કાઉન્સિલરો પોતાની રજૂઆત કરવા જાય તો ભ્રષ્ટાચારના આક્ષેપો કરી તેમનો સૂર દબાવી દેવામાં આવતો હોવાનો આક્ષેપ કાઉન્સિલરોએ કર્યો હતો. ગત સોમવારના રોજ ઉમરેઠ નગરપાલિકાના સાત સભ્યો દ્વારા વિવિધ કમિટીના સભ્યપદેથી રાજીનામું ધરી દેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટી મચી હતી.

બાકરોલમાં મહિલા દર્દીનો વીડિયો ઉતારી દુષ્કર્મ ગુજારનાર તબીબ હજૂ ફરાર

આણંદ

આણંદ પાસેના બાકરોલ ખાતે શ્રીરામ સૃષ્ટિ સોસાયટીમાં રહેતા ડો. રીતેશ બી. પટેલ બાકરોલની વૈભવ સિનેમા સામે આરાધના હોસ્પિટલ એન્ડ મેટરનીટી નામે હોસ્પિટલ ચલાવે છે. વર્ષ-૨૦૧૮માં વિધાનગરની એક પરિણીતા તેઓના ત્યાં સારવાર અર્થે આવી હતી દરમિયાન મહિલાના ચેકઅપ તથા નાના ઓપરેશન સમયે ડો. રીતેશ પટેલે તેણીના નગ્ન ફોટા અને વિડીયો ઉતારી લીધા હતા. બાદમાં યુવતીને તે બતાવી બ્લેકમેઇલ કરી નડિયાદ, વિધાનગર સહિતના અલગ-અલગ સ્થળોએ બોલાવી તેણી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. તબીબના ત્રાસથી કંટાળી જઈ આશરે ત્રણ વર્ષ બાદ આખરે મહિલાએ વિધાનગર પોલીસ મથકમાં ડો. રીતેશ બી. પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

SHARP
INTERNATIONAL
IMMIGRATION SERVICES

CANADA
IMMIGRATION

SPOUSAL SPONSORSHIP
SPECIALIST (98 percent success ratio)

Last minute student admission

Please contact us on
416-745-2466 or 91-9428973911

- Conestoga
- Seneca
- Humber
- Lambton

- Fanshawe
- Georgian
- Algoma
- Canadore

- Algoma
- Saskatchewan polytechnic
- Mohawk

ONLINE IELTS
SPOKEN ENGLISH CLASSES
ON ZOOM

- LMIA/WORK PERMIT • EXPRESS ENTRY
- CANADIAN EXPERIENCE CLASS
- SUPER VISA & VISITOR VISA
- STUDY & WORK PERMIT
- Work / Study /Visitor Permit Extension
- PARENTS/CHILD/SPOUSAL SPONSORSHIP
- REFUGEES/APPEALS /
- DETENTION REVIEWS /
- CRIMINAL PARDONS
- POST GRADUATION WORK PERMIT
- CITIZENSHIP & PR CARD RENEWAL APPLICATIONS

CANADA 94- 499 Main Street South, Shoppers World Mall, Brampton, Ont. Ph : 416-745-2466, 905-230-7855

VADODARA 101-102 Siddharth Complex, Beside Express Hotel, Alkapuri, Vadodara 390007. Ph : 91-94289 73911, 91-95121 57817

AHMEDABAD 139 Iscon Emporio, Beside Star Bazaar Satellite Ahmedabad 380015. Ph : 91-94289 73911, 91-98256 79911

: Specialized in :

Job Offer & LMIA

Entrepreneur

Investor Business

Self Employed

Farm Investor

Email.: info@siis.ca Website.: www.siis.ca



કંગના રનોતની 'ધાકડ' એ માત્ર 2.58 કરોડની કમાણી કરી

મુંબઈ: કંગના રનોતની ફિલ્મ 'ધાકડ'ના નિર્માતાઓને 78 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે કેમ કે કંગના અભિનીત ફિલ્મ ધાકડ 85 કરોડમાં બની હતી અને તેનું બોક્સ ઓફિસ કલેક્શન 2.58 કરોડ રહ્યું છે. ફિલ્મ નિર્માતાઓએ કથિતરીતે ફિલ્મના રાઈટ્સને વેચ્યા નથી. અને હવે કહેવાઈ રહ્યું છે કે બોક્સ ઓફિસ પર પોતાના ખર્ચાને પ્રદર્શનની સાથે નિર્માતાઓને નુકસાન વેઠીને પણ સેટેલાઈટ અને ડિજિટલ રાઈટ્સ વેચવા પડશે. કંગનાની ફિલ્મને કાર્ટિક આર્યનની 'ભૂલ ભૂલેયા 2' નો સામનો કરવો પડ્યો. સારા રિવ્યુ છતાં 'ધાકડ', 'ભૂલ ભૂલેયા 2'ની સામે ટકી શકી નહીં, જે બોક્સ ઓફિસ પર પહેલા નંબરની પસંદ છે.



દિલીપ કુમારને ભારતરત્ન આપવા સાયરા બાનોની માંગ



મુંબઈ : ભારતીય ફિલ્મ ઇતિહાસના સૌથી પહેલા સુપરસ્ટાર દિલીપ કુમારનાં નિધનને આવતા મહિને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે તેમનાં પત્ની અને અભિનેત્રી સાયરા બાનોએ દિલીપ કુમારને ભારતનાં સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નની નવાજેશ કરવા માગણી કરી છે. દિલીપ કુમારને ભારતરત્ન ડો. આરબેડકર એવોર્ડનું મરણોત્તર સન્માન અપાયું છે. આ એવોર્ડ સાયરાબાનુએ સ્વીકાર્યો હતો. જોકે, આ વખતે તેઓ બહુ ભાવુક થઈ ગયાં હતાં અને રડવા લાગ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે દિલીપ સાબને લગતી કોઈ ઈવેન્ટમાં પોતે સામેલ થવાનું ટાળે છે કે હજુ જાહેરમાં આવી શકતાં નથી કારણ કે પોતાની લાગણીઓ પર કન્ટ્રોલ રહેતો નથી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે દિલીપ કુમાર ભારતના કોહિનૂર સમાન હતા. તેમને ભારતરત્નનું મરણોત્તર સન્માન મળવું જ જોઈએ.

સંજય લીલાની હીરામંડી સિરીઝમાં રેખાની એન્ટ્રી



મુંબઈ : જાજરમાન અભિનેત્રી રેખા સંજય લીલા ભણસાળીની વેબ સિરીઝ હીરામંડી દ્વારા ઓટીટી સ્ક્રીન પર એન્ટ્રી કરે તેવી સંભાવના છે. સંજય લીલા ભણસાળી અને રેખા વચ્ચે વાટાઘાટો આખરી તબક્કામાં છે અને ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવના છે. ભણસાળી લાહોરના બહુ ચર્ચિત વિસ્તાર હીરામંડી પર આધારિત વેબસિરીઝ બનાવી રહ્યા છે. સંભવતઃ છ એપિસોડની આ સિરીઝમાં આ બદનામ ગલીઓની તવાચકો તથા તેમનાં ગીતસંગીતની વાતો આવરી લેવાશે. આ સિરીઝ માટે મનિષા કોઈરાલા, સોનાક્ષી સિંઘા અને અદિતી રાવ હૈદરીનાં નામ અગાઉ જ ફાઈનલ થઈ ગયાંનું કહેવાય છે.

માધુરીએ પ્રશંસકો માટે લખ્યો પ્રેમપત્ર

થોડા સમય પહેલા જ બોલીવૂડ ડિવા માધુરી દીક્ષિત-નેનેનું સિંગલ 'તું હે મેરા....' રજૂ થયું. તેની કારકિર્દીનું આ બીજું ગીત હતું. આ ધક્ક ધક્ક ગર્લએ તેનાથી પહેલા કોરોના વોરિયસને સમર્પિત એક કેંડલ ગીત આપીને પોતાના મધુર કંઠનો પરિચય કરાવ્યો હતો. માધુરીએ 'તું હે મેરા...' પોતાના જન્મદિને રજૂ કર્યું હતું. ચોક્કસ સમયે જ પોતાના ગીતો રજૂ કરવા બાબતે અદાકારા કહે છે કે મારા આલબમમાં છ ગીત છે જેમાંથી 'તું હે મેરા....' મેં મારા પ્રશંસકોને સમર્પિત કર્યું છે. વાસ્તવમાં આ ગીત મેં મારા ચાહકો માટે જ લખ્યું છે. આજે હું જે છું તે મારા આ ફેન્સને કારણે જ છું. તેમણે જ મને આ મુકામ સુધી પહોંચાડી છે. ઉપથી પણ વધુ વર્ષથી મને તેમનો નિઃસ્વાર્થ પ્રેમ મળી રહ્યો છે. તેથી મને એમ થયું કે મારે તેમને એકે લવ લેટર લખવો જોઈએ, એક રિટર્ન ગિફ્ટ આપવી જોઈએ. આ ગીત મેં મારા પ્રશંસકોને આપેલી રિટર્ન ગિફ્ટ- પ્રેમ પત્ર છે. બાકી કોરોના કાળમાં આપણને પરિવાર, મિત્રો અને ચાહકોનું મહત્વ સમજાયું. તે વખતે આપણને એ વાતની અનુભૂતિ થઈ કે આપણે ભાવનાત્મક રીતે સજ્જડ જોડાયેલા છીએ. છવંટે મને એમ લાગ્યું કે આટલાં વર્ષથી મારા ચાહકોએ મને જે પ્રેમ આપ્યો છે તેવો જ પ્રેમ મારે પણ તેમના પ્રત્યે વ્યક્ત કરવો જોઈએ. મારાં ગીતો તેમના પ્રત્યેનો મારો પ્રેમ વ્યક્ત કરી રહ્યાં છે.

કહેવાની જરૂર નથી કે સોશયલ મીડિયાનો સમય નહોતો ત્યારે માધુરીને તેના પ્રશંસકો પોસ્ટના માધ્યમથી પત્રો મોકલતાં. અભિનેત્રી પણ તેમને એ રીતે જ ઉત્તર પાઠવતી. આવા જ એક પ્રશંસકને સંભારતા માધુરી કહે છે કે 1૯૯૫માં મારા એક ચાહક મને પત્રો લખતાં. તેમણે મને તે વખતે એક લેટર લખ્યો હતો તેના જવાબમાં મેં તેમને ફોટા અને ઓટોગ્રાફ સાથેનો એક પત્ર પાઠવ્યો હતો. યોગાનુયોગે થોડા સમય પહેલા તેઓ મને મળ્યા ત્યારે તેમણે મને કહ્યું હતું કે મેં મોકલેલો પત્ર તેમણે હજી સુધી સાચવી રાખ્યો છે. એટલું જ નહીં, તેમણે પોતાના વોલેટમાંથી એ પત્ર કાઢીને મને બતાવ્યો ત્યારે હું ગદગદિત થઈ ગઈ હતી. માધુરી અને શ્રીરામ નેને બોલીવૂડમાં આદર્શ યુગલ તરીકે ઓળખાય છે.



સાઈ પલ્લવીના કાશ્મીરી પંડિતોનાં નરસંહાર વિશેનાં વિધાનોથી હોબાળો

શ્યામસિંઘ રોય જેવી ફિલ્મોથી જાણીતી બનેલી સાઈ પલ્લવીએ એક્ટ્રેસ સાઈ પલ્લવીએ કાશ્મીરી પંડિતોનાં નરસંહારને ગાયોની હેરાફેરી માટે મોબ વિંચિંગના બનાવ સાથે સરખાવતાં હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયામાં તેના પર પસ્તાળ પડી રહી છે. જોકે, દરેક સ્વરૂપની હિંસા ખોટી છે તેવાં તેના વિધાનોનો કેટલાક લોકો બચાવ પણ કરી રહ્યા છે. સાઈ પલ્લવીએ તેની નવી ફિલ્મ વિરાટ પર્વમના પ્રચાર માટે આપેલા એક ઈન્ટરવ્યૂમાં કરેલાં વિધાનોથી કેટલાય લોકો ઉકળી ઉઠ્યા છે. આ ફિલ્મમાં સાઈ પલ્લવી એક નક્સલવાદીના પ્રેમમાં પડેલી યુવતીનો રોલ કરી રહી છે. નક્સલહિંસા અંગે તેનો શું અભિપ્રાય છે એવો પ્રશ્ન પૂછતાં સાઈ પલ્લવીએ કહ્યું હતું કે કોઈપણ સ્વરૂપની હિંસા ખોટી છે. હિંસા તમારી વ્યથાને વાચા આપવાનો સાચો માર્ગ ના જ હોઈ શકે. જોકે, સાઈએ એમ કહ્યું હતું કે દરેકનો પોતાનો આગવો દૃષ્ટિકોણ હોય છે. આપણને નક્સલોની હિંસા ખોટી લાગે છે પરંતુ એ વખતે તે લોકોને એવું લાગ્યું હોઈ શકે કે કદાચ ન્યાય મેળવવાનો આ એકમાત્ર ઉપાય છે. કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ વિશે પૂછતાં સાઈએ કહ્યું હતું કે તેમાં કાશ્મીરી પંડિતોની હત્યા કેવી રીતે થઈ તે દર્શાવવામાં આવ્યું છે. પણ તાજેતરમાં કોવિડ વખતે ગાયો લઈને જતા મુસ્લિમ વાહન ચાલક પર હુમલો કરી તેને જય શ્રી રામના નારા પોકારવા ફરજ પડાઈ હતી. જો તમે ધાર્મિક હિંસાની વાત કરતા હો તો આ બંને વચ્ચે શું ફરક છે. તે વખતે એ હિંસા થઈ હતી, આ વખતે આ હિંસા થઈ રહી છે. સાઈના આ નિવેદનોને પગલે ભારે આકોશ વ્યાપ્યો છે.



કોણે કહ્યું કરણ જોહર નેપોટિઝમને ઉત્તેજન આપે છે? : કિયારા અડવાણી

કિયારા અડવાણીની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ભૂલભૂલેયા-૨'ને જબરદસ્ત સફળતા મળી છે અને કિયારાની ગાડી ઝડપભેર આગળ વધી રહી છે. હવે તેની બે ફિલ્મો 'જુગ જુગ જિયો' અને 'ગોવિંદા નામ હે મેરા' તથા એક તેલુગુ ફિલ્મ પણ આવી રહી છે. બીજું, બોયકેન્ડ સિદ્ધાથ મલ્હોત્રા સાથેનો એનો સંબંધ પણ સુધરી ગયાની જાણ તો બધાને છે જ! જો કે હવે કિયારાની વધુ એક વાત બહાર આવી છે. સોશિયલ મીડિયા પર બોલીવૂડના ફેમસ ફેમિલીના સંતાનોને ફિલ્મ સર્જક કરણ જોહર તક આપતા હોવાની વાતને કારણે તેમની જોરદાર ટીકા કરવામાં આવે છે. કિયારા અડવાણી કરણનો બચાવ કરવા મેદાનમાં ઉતરી પડી છે અને ટ્રોલ કરનારા તોફાની તત્વોના કાન પકડી તેમને સાચી વાત કરી છે. દેખીતી રીતે આને કારણે કરણ તો ખુશખુશાલ થાય એ તો સાવ સ્વાભાવિક જ છે. કિયારાએ નેપોટિઝમ અંગે વાત કરી હતી. કિયારાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરણ જોહર પર જે આળ મુકી તેમની જે ટીકા કરવામાં આવી છે તે સાવ ખોટું છે! આમ કહી કિયારાએ એમ પણ જણાવ્યું છે કે બોલિવૂડના સ્ટાર કિડ્સની કેરિયર લોન્ચ કરવામાં અને તેમની સાથે કામ કરવા બદલ ફિલ્મસર્જક કરણ જોહર પર જે ટીકાઓ છોડવામાં આવી રહ્યા તે તમામ ખોટાં છે કેમ કે હું જ્યારે સંઘર્ષરત કલાકાર હતી અને અનેક ડિરેક્ટરોએ મને રિજેક્ટ કરી દીધી હતી ત્યારે કરણ જોહરે જ મારો હાથ પકડ્યો હતો. તે વેળા હું નોબડી છું એવું કહી મને ધૂતકારી કાઢવામાં આવી હતી ત્યારે કરણ જોહરે જ મને સધિયારો આપ્યો.

સમ્રાટ પૃથ્વીરાજ ફ્લોપ જતાં એક મહિનામાં જ ઓટીટી પર આવશે

મુંબઈ: અક્ષય કુમારની સુપર ફ્લોપ ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' તેની રિલીઝ ડેટના એક મહિનામાં જ ઓટીટી પર રિલીઝ થઈ જાય તેવી સંભાવના છે. બોક્સ ઓફિસ પર કંગાળ પ્રદર્શન બાદ ફિલ્મના નિર્માતાઓએ વહેલી તકે ઓટીટી પર રિલીઝનો નિર્ણય લીધાનું મનાય છે. દેશમાં ઓટીટી પર ફિલ્મ રિલીઝનો સિલસિલો ચાલુ થયો તે પછી ફિલ્મ નિર્માતાઓ, ડિસ્ટ્રીબ્યૂટર્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ વચ્ચે એવી સમજૂતી થઈ હતી કે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય તેના આઠ સપ્તાહ પછી ઓટીટી પર રિલીઝ કરવામાં આવે જેથી ડિસ્ટ્રીબ્યૂટર્સ તથા એક્ટિવિટીને નુકસાન ના થાય. જોકે, કોરોના પછીના સમયમાં નિર્માતાઓનું નુકસાન ઘટાડવા મહત્તમ ચાર સપ્તાહ બાદ જ ફિલ્મ



ઓટીટી પર રિલીઝ કરી દેવા સંમતિ સધાઈ હતી. સલમાન ખાનની રાધે ફિલ્મને અપવાદરૂપ સંજોગોને ધ્યાને રાખીને એક જ દિવસે થિયેટર અને ઓટીટી પર રિલીઝ કરવાની છૂટ આપવામાં આવી હતી. હવે જોકે ઓટીટી પ્લેટફોર્મ્સ પણ ફિલ્મોની ખરીદી બાબતે સાવધ થઈ ગયાં છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવી ચાલે છે તેના આધારે તેઓ ફિલ્મની ડીલને રિનેગોશિયેટ કરવાની જોગવાઈ કરારમાં રાખે જ છે. સમ્રાટ પૃથ્વીરાજના કિસ્સામાં પણ ટીકઠાક કલેક્શન આવે તો આઠ સપ્તાહ પછી જ ઓટીટી પર રિલીઝનો નિર્ણય અગાઉ લેવાયો હતો. પરંતુ, ૨૦૦ કરોડના બજેટમાં બનેલી ફિલ્મ હજુ ૬૫ કરોડ રૂપિયાની આસપાસના કલેક્શન પર માંડ પહોંચી છે



હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા ક્લેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર શાણેશાણ માણો !!

રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, સ્મતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

www.swadesh.news

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

info@swadesh.news

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.

410 મેયોના પ્રસારણ બદલ બીસીસીઆઈને અઢળક કમાણીની તક

IPL પ્રસારણ રાઈટ્સ : ડિજિટલ યુગનો દમદાર ઉદય

સમગ્ર દુનિયામાં છેલ્લાં પાંચ-સાત વર્ષથી ટૂંકા સમયની ક્રિકેટ મેચનો કેજ વધ્યો છે. ખાસ કરીને ટી-20, આઈપીએલ જેવા આયોજનો ક્રિકેટ રસીયાઓ માટે ખાસ આકર્ષણરૂપ બની રહ્યા છે. હવે ટૂંક સમયમાં જ આઈપીએલ શરૂ થવાની હોવાથી સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકો અને બિઝનેસ વર્લ્ડની ડેના પર નજર હતી એ ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની હવે પછીની પાંચ સીઝન માટેના બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ એટલે કે પ્રસારણના અધિકારોની હરાજી પ્રક્રિયા પૂર્ણ થઈ છે.

હરાજી પહેલાં જાતજાતના દાવા થતા હતા. આઈપીએલનું આયોજન કરતા બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલે સત્તાવાર રીતે જાહેરાત કરી નથી. પણ મીડિયાનો દાવો છે કે, ટીવી ઉપર મેયોના પ્રસારણ, ડિજિટલ અને ખાસ મેયોના પ્રસારણના રાઈટ્સ કુલ રૂપિયા ૪૮,૩૯૦ કરોડમાં વેચાયા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી પાંચ સીઝન એટલે કે, ૨૦૨૩થી ૨૦૨૭ના વર્ષ માટેના મીડિયા રાઈટ્સની હરાજીનો સોમવારે બીજો અને છેલ્લો દિવસ હતો. આમ છતાં મંગળવારે પણ હરાજીની પ્રક્રિયા ચાલુ રહી અને નોન-એક્સક્લુઝિવ ડિજિટલ મેયોના રાઈટ્સ અને ભારતીય ઉપખંડની બહારના પ્રસારણ માટેના રાઈટ્સ વેચાયા.

મીડિયાના અહેવાલ પ્રમાણે ટીવી રાઈટ્સ ડીઝની હોટસ્ટારને, જ્યારે ડિજિટલ અને નોન-એક્સક્લુઝિવ ડિજિટલ રાઈટ્સ મુકેશ અંબાણીના રીલાયન્સ ગ્રુપની કંપની વાયકોમ-૧૮ને મળ્યા છે. ટીવી ઉપર પ્રસારણના રાઈટ્સ ૫૭.૫ કરોડ રૂપિયા પ્રતિ મેચ, ડિજિટલ રાઈટ્સ ૫૦ કરોડ રૂપિયા પ્રતિ મેચ, જ્યારે નોન-એક્સક્લુઝિવ ડિજિટલ મેચ દીઠ ૩૩.૨૪ કરોડ પ્રતિ મેચના ભાવે રાઈટ્સ અપાયા છે. બીસીસીઆઈએ ૪૧૦ મેયોના પ્રસારણ માટે બોલી લગાવી હતી. તેથી ટીવી ઉપર પ્રસારણના રાઈટ્સમાંથી બીસીસીઆઈને રૂપિયા ૨૩,૫૭૫ કરોડ અને ડિજિટલ રાઈટ્સમાંથી રૂપિયા ૨૦,૫૦૦ કરોડની કમાણી થશે.

એ જ રીતે નોન-એક્સક્લુઝિવ ડિજિટલ રાઈટ્સમાં ખાસ ૮૦ મેયોની બોલી હતી અને તે ૩૨.૫૭ કરોડમાં વેચાયા છે. આ હરાજી પહેલાં એવી વાતો વહેતી થઈ હતી કે, બીસીસીઆઈને ઘી-કેળાં થઈ જશે અને ઓછામાં ઓછી ૬૦ હજાર કરોડની કમાણી થશે. આઈપીએલ શરૂ થઈ ત્યારે લલિત મોદીએ તો ૮૦ અબજ ડોલરની કમાણીનો દાવો કરેલો પરંતુ અત્યારના



અહેવાલોને જોતાં તો આંકડો ૫૦ હજાર કરોડને પાર પણ નથી ગયો.

બીસીસીઆઈએ પોતે જે અંદાજ મૂકેલો તેના કરતાં મળેલી રકમ વધારે છે પણ બહુ વધારે નથી. બોર્ડે ચાર અલગ અલગ કેટેગરીમાં રાઈટ્સ વેચવાનું એલાન કરેલું. તેમાં ટીવી રાઈટ્સ માટે એક મેચની મૂળ કિંમત ૪૮ કરોડ રૂપિયા રાખી હતી. ટીવી પર પ્રસારણના રાઈટ્સ ૫૭.૫ કરોડ રૂપિયા પ્રતિ મેચ લેખે વેચાયા હોય તો બેઝ પ્રાઈસ કરતાં તે ૧૫ ટકા જ વધારે છે. બીજી તરફ ડિજિટલ રાઈટ્સ કલ્પના બહારના

ભાવે વેચાયા છે. તેના ઉપરથી સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે, ડિજિટલ મીડિયા ટીવી ઉપર હાવી થઈ રહ્યું છે અને ભવિષ્યમાં તે ટીવીને પાછળ છોડી દેશે. બોર્ડે દક્ષિણ એશિયામાં ડિજિટલ પ્લેટફોર્મ ઉપર લીગનું પ્રસારણ કરવા માટે એક મેચની બેઝ પ્રાઈસ ૩૩ કરોડ રૂપિયા રાખી હતી. તેના બદલે મેચદીઠ ૫૦ કરોડ રૂપિયા ઉપજ્યા

પ્રાસંગિક
ધવલ શુક્લ

આશ્વાસન લઈ શકે કે, ટીવી કરતાં ડિજિટલ આગળ નીકળ્યું તો પણ ઘી ઢળ્યું તો અંતે બિચડીમાં જ છે. ટીવીમાંથી મળે કે ડિજિટલ રાઈટ્સમાંથી મળે, અંતે કમાણી તો બોર્ડને જ થવાની છે. આ કમાણીના કારણે બોર્ડની બ્રાન્ડ વેલ્યુ વધી છે.

આ હરાજી પછી બોર્ડને આઈપીએલની એક મેચ માટે ૧૧૮ કરોડ રૂપિયા મળશે. એક મેચના પ્રસારણ અધિકારોની રીતે આઈપીએલ હવે વિશ્વની બીજા નંબરની સૌથી મોંઘી લીગ બની ગઈ છે. અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગ નંબર વન છે. એનએફએલને દરેક મેચના પ્રસારણ રાઈટ્સ પેટે ૧૩૩ કરોડ રૂપિયા મળે છે. આઈપીએલ જે રીતે પ્રગતિ કરી રહી છે એ જોતાં હવે પછીની હરાજીમાં નંબર વન બની જાય તો પણ નવાઈ નહીં થાય.

આ વખતે બીસીસીઆઈએ ચાર અલગ અલગ પ્રકારના પ્રસારણના રાઈટ્સની કેટેગરી રાખી હતી. ટીવી અને ડિજિટલ રાઈટ્સ ઉપરાંત

પ્રસારણના રાઈટ્સ 48,390 કરોડમાં વેચાયા છે જેમાં ડિજિટલ પ્લેટફોર્મ ઉપર બેઝ પ્રાઈસ કરતાં પચાસ ટકા વધારે અને ખાસ મેચો માટે ધારણાં કરતા ત્રણ ગણા વધારે 33 કરોડ આવ્યા

હોય તો બેઝ પ્રાઈસ કરતાં પચાસ ટકા વધારે રકમ ઉપજી ગણી શકાય.

બોર્ડની ચાર કેટેગરીમાં ટીવી રાઈટ્સ અને ડિજિટલ રાઈટ્સ પ્રીમિયમ કેટેગરી હતી. તેમાં ડિજિટલ કેટેગરીએ ટીવીને પછાડી દીધું છે. ખાસ મેચો માટે પણ ૧૧ કરોડની બેઝ પ્રાઈસ કરતાં ત્રણ ગણા વધારે ૩૩ કરોડ આવ્યા છે. તેનું કારણ ડિજિટલ પ્લેટફોર્મ છે. જો કે, બોર્ડ એટલું

મેયોનો સમાવેશ થાય છે. તેના માટે મેચદીઠ ૧૧ કરોડ રૂપિયા જ્યારે ભારત સિવાય બાકીના દેશોમાં પ્રસારણ માટે મેચદીઠ ૩ કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ રખાઈ હતી. પહેલી બે સીઝનમાં ૭૪, એ પછીની બે સીઝનમાં સીઝનદીઠ ૮૪ અને છેલ્લી સીઝનમાં સીઝનદીઠ ૮૪ મળીને પાંચ વર્ષમાં ૪૧૦ મેચો રમાશે એવી શક્યતા છે. આઈપીએલમાં અત્યારે ૧૦ ટીમો છે તેમાં વધુ બે ટીમોનો ઉમેરો થશે તેથી કુલ ૧૨ ટીમ થશે.

આઈપીએલની ૨૦૦૮માં શરૂઆત થઈ ત્યારે બીસીસીઆઈએ ટીવી પર પ્રસારણના અધિકાર સિગાપોરની કંપની વર્લ્ડ સ્પોર્ટ ગ્રુપ (ડબલ્યુએસજી)ને ૫૨૩૨ કરોડ રૂપિયામાં ૧૦ વર્ષ માટે આપ્યા હતા. ડબલ્યુએસજીએ સોની ટીવીને ભારતીય ઉપખંડમાં ટીવી પ્રસારણ માટે પહેલા પાંચ વર્ષ માટેના રાઈટ્સ ૧૫૨૪ કરોડ રૂપિયામાં વેચી દીધા હતા. જ્યારે ભારતની બહારના પ્રસારણના રાઈટ્સ પોતાની પાસે રાખ્યા હતા. બોર્ડ અને સોની ટીવી વચ્ચે પહેલી જ સીઝનમાં વિવાદ થઈ ગયો હતો. અનિલ ધીરુભાઈ અંબાણીની કંપનીએ બોર્ડ સાથે ઈન-સ્ટેડિયમ સ્પોન્સરશિપ માટે ૧૩૭ કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. કિન્તુ સોની ટીવીએ તેનાં બોર્ડ બતાવવાના બદલે પોતાને મનફાવે એ રીતે પ્રસારણ કરતાં અનિલે સોદો રદ કરી નાંખ્યો હતો. બોર્ડે સોની ટીવીને તેના માટે જવાબદાર ગણાવીને નુકસાન ભરપાઈ કરવા તાકીદ કરી હતી. જેની સામે સોની ટીવીએ અદાલતનું શરણું લીધું હતું.

કાનૂની લડત પછી બોર્ડ અને સોની ટીવી વચ્ચે સમાધાન થતાં બોર્ડે ૨૦૦૮માં ડબલ્યુએસજી અને સોની ટીવીને ૨૦૧૭ સુધીના પ્રસારણના અધિકાર ૮૨૦૦ કરોડમાં વેચ્યા હતા. આ કરાર ૨૦૧૭માં પૂરો થતાં થયેલી હરાજીમાં ૨૦૧૭થી ૨૦૨૨ના પાંચ વર્ષ માટેના ટીવી અને ડિજિટલ બંનેના રાઈટ્સ સ્ટાર સ્પોર્ટ્સને ૧૬૩૪૭ કરોડ રૂપિયામાં મળ્યા હતા. તેની મુદત આ વર્ષે પૂરી થતાં નવેસરથી હરાજી થઈ રહી છે. આઈપીએલની હરાજી પ્રસારણની દુનિયા કઈ તરફ જઈ રહી છે તેનો સ્પષ્ટ સંકેત આપે છે. ટીવીનું સ્થાન મોબાઈલે લઈ લીધું છે અને યુવાનોને હવે ટીવી ઉપર મેચ જોવાના બદલે મોબાઈલ પર મેચ જોવામાં રસ છે. તેથી ડિજિટલ રાઈટ્સ માટે પડાપડી થઈ રહી છે. ભારતમાં હજુ ડિજિટલ ક્રાંતિની શરૂઆત જ છે ત્યારે આ હાલત છે તો ભવિષ્યમાં આ સેક્ટરમાં મોટા વેપારની તક પણ દેખાઈ રહી છે.



CORDIALLY INVITES



Founder & Inspired By
His Divine Holiness Vallabhacharya Pujya Goswami 108
SHRI VRAJRAJKUMARJI MAHODAYASHRI



**VYO SHRI KRUSHNA DHAM SANKUL
VRAJBHOOMI CALEDON
TORONTO (CANADA)**



ORGANIZING A FUND RAISING
EVENING EVENT OF

**BHAKTI
SANGEET**

S A N D H Y A

By

PRAMESH NANDI



**TICKETS
\$50
PER PERSON
WITH DINNER**

**16th Saturday
July, 2022**

6 pm - 10 pm
(Dinner - 6 pm to 7 pm)

Venue:

**Shri Krushnadhama Sankul-Vrajbhumi
18111 Hwy 50, Caledon, Ontario, Canada**



Master of Ceremony
SANJAY SHAH

Event Leader: Rajesh Shah 647-269-5959

Chairman Kirit Shah (Ottawa) 613-725-4320	President P.K.Shah 416-918-5054	Pujya Shri's Chief Secretary, Canada Sandip Marfatia 416-722-7140	Vice-President Subhash Shah 416-707-7098	Secretary Nimesh Shah 647-784-4743	Treasurer Avni Marfatia 416-471-7140	Fund Raising PR Nikunj Shastri 647-802-5227
---	---------------------------------------	---	--	--	--	---

📍 18111 Highway 50, Caledon, ON L7E 3J9 📞 (416) 421-7373 ✉ canadavyo@gmail.com

Sponsors

Unique Consulting Group Canadian Immigration Services www.unicongroup.com	KRISHNA SHAR, F.Eng. Phone: (416) 270-3655 krishna@cesetec.com www.cesetec.ca	PEGASUS Neerav SB Mortgage Agent www.pegasusmortgage.com	SAAB SAHOTA KING Saab Sahota 905.793.KING (5464) saab@kingrealtyle.com	PHARMASAVE MIT SHAH Pharmacy Manager/Owner PRANAY PARIKH Pharmacy/Owner FARR PHARMACY 17 Fern Hill #5, Bolton, ON, L7E 4H1 Phone: 905.533.3099 Fax: 905.533.5799 Email: pharmita@gmail.com YOLIF COMMUNITY PHARMACY	FINANCIAL HORIZONS GROUP Pravin (P.K.) Shah 888 University Ave. Suite 400, Mississauga, Ontario L4W 5G6 Tel: 905.276.8888 Fax: 905.276.8888 www.financialhorizons.com
Mina Patel Business, Insurance & Wealth Advisor Financial Advisor 647-614-0110 647-905-1100 minapatel.jan@gmail.com www.mpatelwealth.com	JIGNESH PATEL 647-381-1492 jpatel@jignesh.ca	HOMELIFE Dhruval Shah Sales Representative 416-847-9911 905-465-9100 905-490-9130 dshah@hshah.com	KING THINK BIG JOIN KING	WIKKI DUBEATH 647-882-8227 CAPITA FINANCIAL INC. 647-269-8888 info@capitafinancial.com	Shilpesh Parikh 647-992-0958 shilpesh@shilpesh.com www.shilpesh.com
ASHWIN RANINGA Sales Representative 647-294-2890 416-747-0777 416-747-7135 ashwin@ashwinraninga.com	SHRIJI RAMESH PATEL 905-451-4050 647-204-8969	Keyur Shah Lawyer 1780 Alton Rd., Unit # 3, Toronto, ON M5V 1C7 Phone: 416.745.6100 Email: info@shahlaw.ca www.shahlaw.ca	RTI Radiant Technologies Inc. Subhash Shah President 7735 Warden Avenue, Unit #9, Markham, Ontario, Canada L3R 9Y3 Tel: (905) 940-8022 Fax: (905) 943-4144 www.radianttechnologies.ca	ROSEWOOD Ajaypal Singh 416-244-9000 416-882-9010 23 Wilmers Dr., Unit #8, Richmond Hill, Ontario L4B 2Y7	VYO CANADA APPRECIATE AND THANK ALL SPONSORS FOR THEIR GENEROUS DONATION & SUPPORT
NATIONAL BANK Sachin Patel 416-497-9889	HOMELIFE NEEL SONI 416-451-4050	EYECONE OPTICAL SAMIR PATEL, JAYMINI PATEL 416-299-1533, 416-299-1472	PRISM HOMES Dilseep Singh Dhanju 416-294-8116	Joshi Law Office Rakesh Joshi 416-213-8600	

For Tickets Please Contact :
Rajesh Shah (Event Leader) 647-269-5959 P.K. Shah (President) 416-918-5054 Nimesh Shah (Secretary) 647-784-4743 Chetna Shah 647-390-5969
OR Other Board Officers
(Please Strictly Follow Covid-19 Government Guidelines)